



જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦,૨૫૬૩૦૩૦૦,૨૫૬૩૦૪૦૦

ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૭/૮/૨૦૧૪ ગુરૂવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:- સમાચાર યાદી ૨૦૩૫/૧૪

અમદાવાદ શહેરના માધુપુરા, સોલા, નવરંગપુરા, દરીયાપુર વિસ્તારમાં તથા કચ્છ જીલ્લાના ગાંધીધામ ખાતે પિસ્ટલ તથા તિક્ષણ હથિયારો સાથે ધુસી જઇ જુદા જુદા વેપારીઓને હથિયારો બતાવી ઇજાઓ કરી લુંટ કરનાર ગેંગના છ આરોપીઓને ઝડપી પાડતી કાઇમ બ્રાન્ચ,

અમદાવાદ શહેર કાઇમ બ્રાન્ચનાં જોઇન્ટ કમિશ્નર શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં બનેલ ચોરી લુટ ધાડનાં વણ શોધાયેલ ગુન્હાઓ કાઢવા સારૂ આપેલ સુચના આધારે કાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.પી. રોજીયા નાઓનાં માર્ગદર્શન અને સુપરવિઝનમાં કામ કરતા તેઓનાં સ્કોડનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.બી. ઝાલા, તથા સ્કોડનાં માણસો સાથે અમદાવાદ શહેરમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે, અમદાવાદ કાલુપુર મીટર ગેજ રેલ્વે સ્ટેશન પાસે પાર્કિંગ પાસેથી આરોપીઓ (૧) મોહમદઇરશાદ @ મુલ્લા S/O દોલતભાઇ બદરૂદ્રીન ધાંચી ઉ.વ.૩૦ રહે, બ્લોક નં.૧૬૧/૯૭૪, ગુજરાત હાઉસીંગ બોર્ડ, લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડીયમ સામે રખિયાલ અમદાવાદ શહેર (૨) મહમદઅયુબ S/O મહમદયાકુબ અબ્દુલકરીમ જાતે શેખ ઉ.વ.૩૦ રહે, બ્લોક નં. ૭૬૩/૫૧૬૫, ગુજરાત હાઉ બોર્ડ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડીયમ સામે બાપુનગર અમદાવાદ શહેર (૩) આસીફખાન હનીફખાન જાતે પઠાણ ઉ.વ.૨૯ રહે, ઘર નં.૧૩૦, ગ્રીન ચાલી નારાયણી હોસ્પિટલ સામે રખિયાલ અમદાવાદ શહેર (૪) મહમદવસીમ S/O નીજામુદીન અબ્દુલરજાક જાતે અંન્સારી ઉ.વ.૨૩ રહે, ૧૦૫/૨૫, લાલજીભાઇ ફકીરની ચાલી, નારાયણી હોસ્પિટલની સામે, મોનોગ્રામ મીલ સામે રખિયાલ અમદાવાદ શહેર (૫) સાબીરખાન S/O હાકીમઅલી સબીરખાન જાતે પઠાણ ઉ.વ. ૩૦ રહે, સૈયદવાડી મકદુમનગર વિભાગ-૩ મુન્નાભાઇ સિલાઇવાળાનાં મકાનમાં વટવા અમદાવાદ શહેર (૬) અબ્દુલરજાક ઉર્ફે ભયુ S/O ઇસ્માઇલભાઇ તાવીજઅલી જાતે શેખ ઉ.વ.૩૮ રહે, નં.૫/૧૩૨, વસંત ગજેન્દ ગડકરનગર રીવરફ્રન્ટનાં મકાન, વટવા રેલ્વે કોસીંગ પાસે, વટવા અમદાવાદ શહેર નાઓને તા.૦૬/૦૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરેલ છે.

આ કામનાં આરોપીઓની પુછપરછ કરતા સને ૨૦૦૭ ની સાલમાં આરોપી મોહમદઇરશાદ @ મુલ્લા તથા અબ્દુલરજાક ઉર્ફે ભયુ તથા એક પઠાણ નામના માણસ સાથે ભેગા મળી બાઇક ઉપર સોલા સુરધારા સર્કલ પાસે એક વેપારી ને ગળાના ભાગે છરી મારી ઇજા પહોચાડી વેપારી પાસેથી થેલો ઝુટવી લેવાની કોશીષ કરેલ પરંતુ લોકોના ટોળા ભેગા થઇ જતાં થેલો મુકી ભાગી ગયેલ.

તેમજ સને ૨૦૦૬ ની સાલમાં અબ્દુલરજાક ઉર્ફે ભયુ તથા મહેબુબ શેખ નાઓ ભેગા મળી બાઇક ઉપર જઇ નવરંગપુરા લખોડી તલાવડી પાસે એક વેપારીને આંતરી ગળાના ભાગે તથા પેટના ભાગે છરી વડે જીવલેણ ઇજા પહોચાડી વેપારી પાસેથી રૂ.૫૫,૦૦૦/-ની લુંટ કરી નાસી ગયેલ.

તેમજ સને ૨૦૧૨ ની સાલમાં મોહમદઇરશાદ @ મુલ્લા તથા મહમદઅયુબ તથા આસીફખાન તથા મહમદવસીમ તથા સાબીરખાન નાઓ ભેગા મળી કચ્છ જીલ્લાના ગાંધીધામ ખાતે રેલ્વે સ્ટેશન વાળા રોડ ઉપર આવેલ આંગડીયા પેઢી ની ઓફીસમા ધુસી જઇ કર્મચારીઓને બે પિસ્ટલ તથા છરી જેવા હથિયારો બતાવી રૂ.૧,૦૫૦૦૦/- ની લુંટ કરેલ આ વખતે લોકો ભેગા થઇ જતા મોહમદઇરશાદ @ મુલ્લા પાસેની પિસ્ટલ ત્યાંજ સ્થળ ઉપર પડી ગયેલ અને તમામ આરોપીઓ લુંટનો અંજામ આપી અલગ અલગ રીતે નાસી ગયેલ.

તેમજ સને ૨૦૧૨ ની સાલમાં મોહમદઇરશાદ @ મુલ્લા તથા તેના સાગરીતો ભેગા મળી માધુપુરા માકેટમા કરીયાણાના એક વેપારીની ઓફીસમા હથિયારો સાથે ધુસી જઇ વકરાના રોકડ નાણા રૂ.૧,૫૦,૦૦૦/- તથા વેપારીએ પહેરેલ સાઓનાની ચેઇન તથા સોનાની વિટીની લુંટ કરી તમામ આરોપીઓ નાસી ગયેલ.

ત્યારબાદ ચાલુ સાલે અબ્દુલરજાક ઉર્ફે ભયુ તથા તેના તેના સાગરીતો સિકંદર તથા દીલાવર નાઓ સાથે ભેગા મળી એક વેપારીને કાલુપુર કુટ માકેટ થી ઓટોરીક્ષામા બેસાડી પ્રેમ દરવાજા સુધી મા વેપારી પાસેના રૂ.૩,૯૦,૦૦૦/- રોકડા કાઢી લઇ આગળ ચેકીંગ છે તેમ કહી વેપારીને ઓટોરીક્ષામાંથી નીચે ઉતારી ઓટોરીક્ષા લઇ નાસી ગયેલ..

ઉપરોક્ત બનાવ સબંધે અમદાવાદ શહેરમાં માધુપુરા, સોલા, નવરંગપુરા, દરીયાપુર વિસ્તારમા તથા કચ્છ જીલ્લાના ગાંધીધામ પો.સ્ટે.મા ગુનાઓ દાખલ થવા પામેલ છે.આ કામે પકડાયેલ આરોપીઓ પૈકી મોહમદઇરશાદ @ મુલ્લા તથા અયુબ તથા તેના સાગરીતો સને ૨૦૧૩ ની સાલમાં બાપુનગર અયુબ મુલતાણી ના ખુન કેશમા પકડાયેલ છે.જ્યારે અબ્દુલરજાક ઉર્ફે ભયુ અગાઉ બચ્ચેગ લીફ્ટીંગ તથા ઓટોરીક્ષામા પેસેન્જરોના સ્વાંગમા બેસી પેસેન્જરોના માલસામાન માંથી રોકડ રકમ તથા કિંમતી દાગીનાની ચોરી લુંટ કરવાના ગુનામાં પકડાયેલ છે. તેમજ પાસા હેઠળ અટકાયત પણ કરવામા આવેલ છે. આમ પકડાયેલ આરોપીઓ ચોરી લુંટફાટ કરવાની ટેવવાળા હોય તેઓને પકડી અટક કરવામા આવેલ છે. અને સને ૨૦૦૬, ૨૦૦૭. ૨૦૧૨, તથા સને ૨૦૧૪ ના અનડીટેક લુટ તથા ઘાડના ગુન્હાઓ શોધી કાઢેલ છે.અને આવા બીજા કેટલા ગુનાઓ આચરેલ છે તે દીશામા તપાસ તજવીજ હાથ ધરવામા આવેલ છે.

નાયબ પોલીસ કમિશનર  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર  
પોલીસ કમિશનર વતી.